

રૂા. ૨૦/– ના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું થતું સોગંદનામું

આથી હું (અટક) (નામ)
(પિતાનું નામ) ઉંમર
રહેવાસી આથી
સોગંદ ઉપર જાહેર કરૂ છું કે, **વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી** સાથે સંલગ્ન
.....કોલેજ/અનુસ્નાતક ભવન / કેન્દ્રનો હું
સને ના શૈક્ષણિક વર્ષમાં વિઘાર્થી / વિઘાર્થીની હતો/હતી, મેં માર્ચ / એપ્રિલ –
ઓક્ટો. /નવેમ્બર માં લેવાયેલ પરીક્ષાના બેઠક
નંબરથી કેન્દ્રમાંથી પરીક્ષા આપી હતી, આ પરીક્ષાનું મને
અસલ પદવી પ્રમાણપત્ર/માર્કશીટ મળેલ છે જે અસલ પદવી પ્રમાણપત્ર / માર્કશીટ મારાથી
ખોવાઈ/ચોરાઈ/ફાટી ગયેલ છે.(અન્ય
કારણ હોયતો તો તે દર્શાવવું). ભવિષ્યમાં મને જો અસલ પદવી પ્રમાણપત્ર/ માર્કશીટ મળી જશે તો
તે હું પરત કરીશ. આ એફીડેવીટ..... પરીક્ષાની ડુપ્લીકેટ ડિગ્રી સર્ટિફિકેટ /
ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે કરેલ છે.

સહી.....

તારીખ :

સ્થળ :

(સોગંદનામું સક્ષમ અધિકારી સમક્ષ થયેલ હોવું જોઈએ)

**FORMAT OF NOTARIZED AFFIDAVIT TO BE EXECUTED FOR
OBTAINING DUPLICATE DEGREE CERTIFICATE
[ON NON JUDICIAL STAMP PAPER OF Rs. 20/-]**

I under signed, [Surname] _____

[Name] _____

[Father's/Husband's Name] _____

[Age] _____ Years

[Full Residential Address] _____

hereby declare on oath that I was student of [Name of College/Department] _____ during the educational Year _____ affiliated to Veer Narmad South Gujarat University, Surat. I had appeared in the examination of _____ in March/April-October/November _____ with Seat No. _____ from the _____ Centre. I had received the Degree Certificate / Mark Sheet from Veer Narmad South Gujarat University for aforesaid examination, which is lost/stolen/torned _____ (if any other reason, please write) by me and not traceable in spite of my sincere efforts.

I will not misuse the Duplicate Degree Certificate / Mark Sheet if it is issued to me and I will return the Original Degree Certificate / Mark Sheet, if I find the same in future. The said affidavit done for getting the Duplicate Degree Certificate/ Duplicate Mark Sheet.

Signature _____

Place :

Date :